

July 26, 2021

BSE Limited
Listing Department
Phiroze Jeejeebhoy Towers,
1st floor
Dalal Street
Mumbai 400 001

National Stock Exchange of India Limited Listing Department Exchange Plaza, 5th floor Plot No. C/1, G Block Bandra-Kurla Complex Bandra (East) Mumbai 400 051

Dear Sirs,

Sub: Newspaper Publication

Pursuant to Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please note that:

- Extract of Unaudited Financial Results (Standalone and Consolidated) for the quarter ended June 30, 2021 has been published in Financial Express (all editions) and Vadodara Samachar (Vadodara edition) on July 25, 2021.
- Notice of Annual General Meeting has been published on July 25, 2021 in Financial Express (all editions), Indian Express (Vadodara edition) and Vadodara Samachar (Vadodara edition). The same has also been published in Business Standard (all editions) today i.e. on July 26, 2021.

We enclose herewith the copies of newspaper advertisements published in Financial Express (Mumbai edition) and Vadodara Samachar.

You are requested to please take the above on record.

Yours sincerely, For ICICI Bank Limited

Vivek Ranjan Chief Manager

Encl: As above

ICICI Bank Limited ICICI Bank Towers

Bandra-Kurla Complex Mumbai 400 051, India. Tel.: (91-22) 2653 1414 Fax: (91-22) 2653 1122 Website <u>www.icicibank.com</u> CIN.: L65190GJ1994PLC021012

Regd. Office: ICICI Bank Tower,

Near Chakli Circle, Old Padra Road Vadodara 390007. India WWW.FINANCIALEXPRESS.COM

OURNALISM OF COURAGE

2

TheIndian



Intelligent. The Indian Express the For

LOST SHARE CERTIFICATES

We, Mohan Mulraj Bherwani (New York State ID : 285095100) and Kishin Mulraj Bherwani (Deceased) jointly holding 10 shares of Bosch Limited (formerly: Motor Industries Company Limited)Hosur Road,Adugodi,Bangalore-560030 in Folio No. B00220 bearing Share Certificate Numbers: V0003092 and VN000568 with distinctive Numbers from 93336 to 93340 and 707131 to 707135 respectively for 10 shares of INR 100/-each. I do hereby give notice that the said Share Certificates are lost and I have applied to the Company for issue of duplicate Share Certificates and exchange of the same with Face value of INR 10/-

The public is hereby warned against purchasing or dealing in anyway with the said Share Certificates. The Company may issue duplicate Share Certificates if no objection is received by the company within 30 days of the publication of this advertisement, after which no claim will be entertained by the Company in that

Date: 24.7.21 Mohan Mulraj Bherwani Place: USA

SML ISUZU LIMITED

CIN: L50101PB1983PLC005516

Regd Office & Works: Village Asron, Distt. Shahid Bhagat Singh Nagar (Nawanshahr) Punjab -144 533. Phone: 01881-270255; Fax: 01881-270223 Email: investors@smlisuzu.com, Website: www.smlisuzu.com

NOTICE TO SHAREHOLDERS TRANSFER OF UNCLAIMED DIVIDEND (FY 2013-14) AND SHARES TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

Pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, Members are hereby informed that unclaimed dividend for the financial year ended 31st March, 2014 and the respective Shares of the Company in respect of which dividend have remained unclaimed for seven consecutive years from the financial year ended 31st March, 2014 will be due for transfer to the Investor Education and Protection Fund (IEPF) on 28th October, 2021.

The Company has uploaded full details of concerned Shareholders and number of Shares due for transfer to IEPF on its website (www.smlisuzu.com) at the weblink https://smlisuzu.com/StaticFiles/SHAREHOLDERS LIST-WEBSITE 2013-14.pdf. Individual letters in this regard have also been sent to the concerned shareholders at the registered address available with the Company.

The concerned shareholders are requested to claim the unclaimed dividend by 28th October, 2021 failing which the Company will proceed to transfer the unclaimed dividend and respective shares to the IEPF Authority, in accordance with the aforesaid provisions of law.

For any information/query on this matter, concerned shareholders may contact the Company or its Registrar and Share Transfer Agent at the following address:

SML ISUZU Limited Corporate Office: SCO 204-205, Sector 34-A, Chandigarh-160022 Tel: 0172-2647700-02 E-mail address: investors@smlisuzu.com

Dated: 24.07.2021

Place: Chandigarh

MCS Share Transfer Agent Limited Unit: SML ISUZU Limited Sri Venkatesh Bhavan, F-65, 1st Floor, Okhla Industrial Area, Phase - I New Delhi - 110020 Tel: 011-41406149 E-mail address: helpdeskdelhi@mcsregistrars.com

For SML ISUZU LIMITED PARVESH MADAN Company Secretary ACS-31266

ARICENT TECHNOLOGIES (HOLDINGS) LIMITED CIN: U72100DL2006PLC149728

Registered Office: 5. Jain Mandir Marg (Annexe.), Connaught Place, New Delhi -110001 Tel: +91 011-23747336 E-mail: all_cosec@altran.com

POSTAL BALLOT NOTICE

Members of Aricent Technologies (Holdings) Limited ("the Company") are hereby nformed that pursuant to Section 67 of the Companies Act, 2013 read with Rule 16 of The Companies (Share Capital and Debentures) Rules, 2014 of the Companies Act, 2013 ("the Act") read with Section 108 and 110 and other applicable provisions, if any of the Act read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, (including any statutory modification(s), amendment(s) or re-enactment(s) thereof, for the time being in force) ("the Rules") read with General Circulars No. 14/ 2020 dated April 8, 2020, No. 17/2020 dated April 13, 2020, No. 22/2020 dated June 15, 2020, No. 33/2020 dated September 28, 2020, No. 39/2020 dated December 31 2020 and No. 10/2021 dated June 23, 2021 in relation to "Clarification on passing of ordinary and special resolutions by companies under the Companies Act, 2013 and the rules made thereunder on account of the threat posed by Covid-19" issued by the Ministry of Corporate Affairs, Government of India ("the MCA Circulars"), Secretarial Standard - 2 Issued by the Institute of Company Secretaries of India and other applicable laws and regulations, if any, the Company has sought the approval of the members to transact the special business as set out in the Postal Ballot Notice dated July 19, 2021 ("the Postal Ballot Notice") by passing the special resolution by postal ballot mechanism through the remote e-voting process.

In this connection, the Company has sent the Postal Ballot Notice on July 24, 2021 by email to all those members whose names appear in the Register of Members/list of beneficial owners as on cut-off date i.e. Friday, July 16, 2021 and who have registered their email address with the Company (in respect of shares held in physical form) and or with their Depository Participants (in respect of shares held in dematerialized form and made available to the Company by the respective Depositories.

To enable participation in the remote e-voting process by those members who have not registered their email addresses, to whom physical Postal Ballot Notice could not be despatched on account of threat posed by Covid-19, the Company has made appropriate arrangements with its Registrar & Transfer Agent viz. KFin Technologies Private Limited ("KFin" formerly known as Karvy Fintech Private Limited) for registration of email addresses in terms of the above-mentioned circulars.

The Process for registration of email addresses is as under:

dematerialized Mode:

Members who hold shares in Members who hold shares in physical

- link: the ris.kfintech.com/clientservices/ postalballot/registration.aspx (b) Select the company name
- https:// clientservices/postalballot/registration
- (c) Shareholder to enter DPID-CLID (c) Shareholder to enter physical Folio No
- Folio No. and PAN No. (d) Shareholder to enter the email id (d) If PAN No. is not available in the records.
- and mobile no. (e) System check the authenticity of the client id and PAN and send the different One-time Passwords
- to validate. Shareholder to enter the OTPs received by SMS and email id to complete the validation process.
- (OTPs will be valid for 5 minutes g) System confirms the email id for
- postal ballot notice. (h) System will send the notice & procedure for e-voting to the email

given by shareholder.

Place: New Delhi Date: July 25, 2021

- (a) Visit the link: https://ris.kfintech.com/
- (b) Select company name
- and PAN No.
- shareholder to enter one of the Certificate No. (e) Shareholder to enter the email id and
- (OTPs) to mobile no. and email id (f) System check the authenticity of the
 - Folio No. and PAN/Certificate No. and send the different OTPs to mobile no. and email id to validate (g) Shareholder to enter the OTPs received
- by SMS and email id to complete the validation process. (OTPs will be valid for 5 minutes only). the limited purpose of serviced (h) If PAN is not available, system will
 - prompt to upload the duly signed scan copy of the PAN. (i) System confirm the registration of email id.
 - (j) System will send the notice & procedure for e-voting to the "email id" given by

Post successful registration of the email, the shareholder would get soft copy of the Postal Ballot Notice and the procedure for remote e-voting along with the User ID and the Password to enable the members to cast their vote by remote e-voting. Members are requested to permanently register their email addresses, in respect of electronic holding with the depository through concerned Depository Participants and in respect of physical holding with KFin. No Hard Copy of the Postal Ballot Notice shall be sent to the members and therefore, as per the MCA Circulars, the members are required to communicate their assent/dissent for the above-mentioned resolution through "remote e-voting" systems only.

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the Depositories, as on the cut-off date i.e. Friday, July 16, 2021 shall only be entitled to cast their vote by remote e-voting on the resolution mentioned in the Postal Ballot Notice.

Members can vote during the remote e-voting period commencing from Monday, July 26, 2021 at 09:00 am (IST) and ending on Tuesday, August 24, 2021 at 05:00 PM (IST). The remote e-voting module shall be disabled on Tuesday, August 24, 2021at 05:00 PM (IST and remote e-voting shall not be allowed thereafter. Once the vote on a resolution is cast by a Member, the Member shall not be allowed to change it subsequently.

Mr. Javant Gupta, Partner of M/s Javant Gupta & Associates, Company Secretaries, (CP No. 9738) has been appointed as Scrutinizer for conducting the Postal Ballot (remote e-voting) process in accordance with law and in a fair and transparent manner. The Postal Ballot Notice is available on the website of KFin at https:/ evoting.kfintech.com/ and those members who have not received the Postal Ballot Notice may download the same from this website

The results of the voting conducted through the postal ballot shall be declared on or before Thursday, August 26, 2021 and would be displayed on the website of KFin at https://evoting.kfintech.com/

To understand the process of remote e-voting, Members are requested to go through the notes to the Postal Ballot Notice or they may refer to the FAQs at https:/ evoting.kfintech.com/. For any grievance or query related to remote e-voting or email registration, Members may contact Company's RTA person, Mr. Anandan K., Manager-Registrar in Securities, Selenium, Tower- B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Hyderabad, Telangana - 500 032, Tel No. 1800 309 4001 and email id at einward.ris@kfintech.com and/or may write to all_cosec@altran.com.

> Aricent Technologies (Holdings) Limited VP-Legal & Company Secretary



ICICI BANK LIMITED

CIN-L65190GJ1994PLC021012

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara - 390 007. Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051. Phone: 022-26538900, Fax: 022-26531230, Email: investor@icicibank.com

Website: www.icicibank.com

FINANCIAL RESULTS

(₹ in crore)

| | Particulars | STANDALONE | | | CONSOLIDATED | | |
|------------|---|-------------------------------|-------------------------------|------------------------------|-------------------------------|-------------------------------|-------------------------------|
| | | Three months ended | | Year ended | Three months ended | | Year ended |
| Sr. no. | | June 30, 2021 (Q1-2022) | June 30, 2020 (Q1-2021) | March 31,2021 (FY2021) | June 30, 2021 (Q1-2022) | June 30, 2020 (Q1-2021) | March 31, 2021 (FY2021) |
| | | (Unaudited) | (Unaudited) | (Audited) | (Unaudited) | (Unaudited) | (Audited) |
| 1. | Total income from operations (net) | 24,379.27 | 26,066.95 | 98,086.80 | 38,852.60 | 37,939.32 | 161,336.48 |
| 2. | Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 6,042.71 | 3,182.50 | 20,182.72 | 6,678.59 | 4,587.30 | 26,028.33 |
| 3. | Exceptionalitems | | | | | | |
| 4. | Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 6,042.71 | 3,182.50 | 20,182.72 | 6,678.59 | 4,587.30 | 26,028.33 |
| 5. | Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 4,616.02 | 2,599.15 | 16,192.68 | 4,747.42 | 3,117.68 | 18,384.32 |
| 6. | Total comprehensive income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)] (refer note no. 5) | N.A. | N.A. | N.A. | N.A. | N.A. | N.A. |
| 7. | Paid-up equity share capital (face value ₹ 2 each) | 1,385.22 | 1,295.41 | 1,383.41 | 1,385.22 | 1,295.41 | 1,383.41 |
| 8. | Reserves excluding revaluation reserves | 147,894.71 | 114,205.75 | 143,029.08 | 158,070.47 | 121,705.39 | 153,075.71 |
| 9. | Earnings per share (EPS): | | | | | | |
| | Basic EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹) | 6.67 | 4.01 | 24.01 | 6.86 | 4.82 | 27.26 |
| | Diluted EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹) | 6.54 | 3.98 | 23.67 | 6.72 | 4.76 | 26.83 |

Notes:

Mumbai

July 24, 2021

1. During FY2021, the Covid-19 pandemic resulted in a nation-wide lockdown in April-May 2020 which substantially impacted economic activity. For the banking sector, these developments resulted in lower demand for loans and fee-based services and regulatory measures like moratorium on payment of dues and standstill in asset classification to mitigate the economic consequences on borrowers. It also resulted in increase in provisioning reflecting higher actual and expected additions to nonperforming loans. The easing of lockdown measures subsequently led to gradual improvement in economic activity and progress towards normalcy from the second

The second wave of the Covid-19 pandemic in April-May 2021 led to the re-imposition of localised/regional lock-down measures in various parts of the country. In the absence of regulatory dispensations like moratorium on loan repayments and standstill on asset classification, the impact on the quality of the loan portfolio would likely be sharper and earlier during fiscal 2022. The second wave has started to subside from June 2021 onwards and there has been a gradual lifting of lock downs, resulting in an increase in economic activity.

During Q1-2022, the Bank wrote-back Covid-19 related provision of ₹ 1,050.00 crore based on the updated position of various portfolios underlying these provisions (made Covid-19 related provision of ₹5,550.00 crore in Q1-2021) and accordingly held Covid-19 related provision of ₹6,425.00 crore at June 30, 2021. The impact, including with respect to credit quality and provisions of the Covid-19 pandemic on the Bank and the Group, is uncertain and will depend on the trajectory of the pandemic, progress and effectiveness of the vaccination programme, the effectiveness of current and future steps taken by the government and central bank to

The Bank made net Covid-19 related provision of ₹ 4,750.00 crore in FY2021 and held an aggregate Covid-19 related provision of ₹ 7,475.00 crore at March 31, 2021.

- mitigate the economic impact, steps taken by the Bank and the Group and the time it takes for economic activities to return to pre-pandemic levels. 2. In Q1-2022, the Bank has changed its provisioning policy on non-performing advances to make it more conservative. The aforementioned change resulted in higher provisions on non-performing advances amounting to ₹1,127.15 crore in Q1-2022.
- During Q1-2021, the Bank sold equity shares in its subsidiaries and made a net gain of ₹3,036.29 crore in standalone financial results and ₹2,715.87 crore in consolidated financial results (during FY2021: net gain ₹3,669.94 crore in standalone financial results and ₹3,297.05 crore in consolidated financial results).
- During Q1-2022, the Bank has allotted 9,044,970 equity shares of ₹2 each pursuant to exercise of employee stock options.
- The Indian Accounting Standards (Ind AS) are currently not applicable to banks in India.

Note: The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results is available on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and the Bank's website (www.icicibank.com).

For and on behalf of the Board of Directors

Vishakha Mulye **Executive Director**

DIN-00203578



ICICI BANK LIMITED CIN-L65190GJ1994PLC021012

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara 390 007, Gujarat, Phone: 0265-6722286 Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Mumbai 400 051, Maharashtra, Phone: 022-26538900, Fax: 022-26531230 Website: www.icicibank.com, Email: investor@icicibank.com

NOTICE OF TWENTY-SEVENTH ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the Twenty-Seventh Annual General Meeting | evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager, National Securities (AGM) of the Members of ICICI Bank Limited (the Bank/Company) will be held on Friday, August 20, 2021 at 3:00 p.m. IST through Video Conferencing/Other Audio Visual Means (VC/OAVM) to transact the Ordinary and Special Business, as set out in the Notice of the AGM in compliance with applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder read with General Circular Nos.14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs (MCA).

The Bank has on July 23, 2021 sent the Notice of the AGM and Annual Report 2020-21 through electronic mode only to those Members whose email addresses are registered with the Bank/Depository Participants in accordance with the above mentioned MCA Circulars and Circulars dated May 12, 2020 and January 15, 2021 issued by the Securities and Exchange Board of India. The Notice of the AGM and Annual Report 2020-21 can also be accessed on the Bank's website at https://www.icicibank.com/aboutus/annual.html, the website of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Members can participate in the AGM through VC/OAVM facility by following the instructions mentioned in the Notice of the AGM. The Bank is pleased to provide the Members the facility to exercise their right to vote at the AGM by electronic means. The Bank has appointed NSDL for facilitating voting through electronic means. Members including those who are holding shares in physical form or who have not registered their email addresses, can cast their votes by following the instructions mentioned in the Notice of the AGM.

Members are also informed that:

- The remote e-voting period commences on Monday, August 16, 2021 (9:00 a.m. IST) and ends on Thursday, August 19, 2021 (5:00 p.m. IST) The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The remote e-voting shall not be allowed beyond the said date and time. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently;
- The facility for e-voting will be made available to the Members during the
- Members who have cast their votes through remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes
- e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. 5. A Person whose name is recorded in the Register of Members or in the

4. Members who have not cast their votes on the Resolutions through remote

Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-

off date i.e. Friday, August 13, 2021 only shall be entitled to avail the facility

of remote e-voting as well as e-voting during the AGM. Any person, who acquires shares of the Company and becomes Member of the Company after the date of sending of the Notice of the AGM and holds shares as on the cut-off date i.e. Friday, August 13, 2021, can cast the vote by

following the instructions mentioned in the Notice of the AGM. In case of any queries or issues or grievances pertaining to e-voting, Members may refer to Help/FAQ's section available at www.evoting.nsdl.com or call on toll free no.: 1800-1020-990/1800-224-430 or send a request at Date : July 24, 2021

Depository Limited, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013, at pallavid@nsdl.co.in or at telephone no.: +91-22-24994545. Alternatively, Members may also write to the Company Secretary of the Bank at investor@icicibank.com or contact at telephone no.: +91-22-26538900.

Members holding shares in dematerialised form are requested to register/update their email addresses with their Depository Participants. Members holding shares in physical form and who have not updated their email addresses with the Bank are requested to update their email addresses by writing to the Bank or 3i Infotech Limited, Registrar and Share Transfer Agent (R & T Agent), Tower # 5, 3rd Floor, International Infotech Park, Vashi Railway Station Complex, Vashi, Navi Mumbai 400 703 along with the copy of signed request letter mentioning the name, address and folio number, self-attested copy of the PAN Card, copy of the share certificate (front and back), and selfattested copy of any document (eg.: Aadhaar Card, Driving License, Election Identity Card, Passport).

The Board of Directors at their Meeting held on April 24, 2021 have recommended payment of dividend of ₹ 2 per equity share of face value of ₹ 2 each for the financial year ended March 31, 2021. The Record Date for determining the names of members eligible for dividend on equity shares, if declared at the AGM, is July 30, 2021.

Members holding shares in dematerialised form are requested to update their bank account details (including 9 digit MICR no. and 11 digit IFSC code no.) with their Depository Participants. Members holding shares in physical form are requested to update their bank account details (including 9 digit MICR no. and 11 digit IFSC code no.) by sending signed request letter mentioning their name, address and folio number to the Bank or Bank's R & T Agent along with selfattested copy of the PAN Card, copy of the share certificate (front and back), cancelled Cheque leaf and the self-attested copy of any document (e.g.: Aadhaar Card, Driving License, Election Identity Card, Passport).

As per the Income-tax Act, 1961 (the Act), as amended by the Finance Act, 2020, dividend paid or distributed by Bank after April 1, 2020 shall be taxable in the hands of the Members. The Bank shall therefore be required to deduct tax at source (TDS) at the prescribed rates at the time of making the payment of dividend to the Members. All communications/queries in this respect should be sent at icicibankdivtax@3i-infotech.com.

In order to enable Bank to determine the appropriate tax rate at which tax has to be deducted at source under the respective provisions of the Act, Members are requested to provide the relevant documents/forms/declarations as may applicable to them at https://14.141.70.64/LIVE_TDS/TDSDocument Collection.aspx on or before August 2, 2021 (6.00 p.m. IST). The dividend will be paid after deduction of tax at source as determined on the basis of the documents provided by the Members as applicable to them and being found to be complete and satisfactory in accordance with the Act. For more details, Members are requested to refer to the instructions mentioned in the Notice of the AGM. Members are also requested to update their tax residential status, PAN with the Bank or Bank's R & T Agent (where the shares are held in physical form) and with the Depository Participants (where the shares are held in demat form).

> By Order of the Board Sd/-Ranganath Athreya Company Secretary

Place: Mumbai

Indian

વકોદરા સમાચાર

વિશ્વભરમાં જંગલોનો સફાચો થઇ જશે તો ?

વિશ્વના દેશો વિકાસની આંધળી દોડમાં માનવજાત, પશુ-પક્ષી સહિતના જીવોને ઓક્સિજન આપતા વૃક્ષોનું આડેધડ મોટા પ્રમાણમાં નિકંદન કાઢી રહ્યા છે. તે સાથે લગભગ દેશો જળ અને વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં પેદા કરી રહ્યા છે. જેની સામે કુદરત વિવિધ રીતે વિશ્વના દેશોને ચેતવણી આપતી આવી છે છતાં વિશ્વના દેશો આ બાબતને ગંભીરતાથી લેતા નથી ત્યારે લાગે છે કે વિકાસની આંધળી દોડમાં સમગ્ર જવ સૃષ્ટી માટે દોઝખ ઊભુ થઈ જશે અને માનવજાત, પશુ પક્ષી સહિતના જીવો અને અંતિમ મંજીલ જનારાઓની સંખ્યા બેહદ વધી જશે ! માનવ જાત, પશુ- પક્ષીઓ સહિતના જીવોને જીવવા માટે ઓક્સિજન મળતો રહેવો જરૂરી છે. અને તે ઓક્સિજન કુદરતી સંપદા પૂરો પાડે છે જેમા વૃક્ષો અને સમુદ્રી શેવાળ સહિતની સમુદ્રી વનસ્પતિ વગેરે મુખ્ય છે.તો રોગો પેદા કરતા ફેલાવતા જીવ જંતુ પક્ષીઓનો આહાર છે. ઉપરાંત પક્ષીઓ જે તે વૃક્ષોના ફળો આરોગે છે અને તે અહીં તહીં ઉડતા રહેતા ગમે ત્યાં હંગાર કરતા રહે છે તેની હંગારમા ખાધેલ વૃક્ષ ફળના બીજ હોય છે અને અનુકૂળ જગ્યાએ તે બીજમાથી વૃક્ષ ઊગી નિકળે છે એટલે પક્ષીઓ પણ માનવજાત માટે ઉપયોગી છે. આ બધું આદીઅનાદિ કાળથી જગજાહેર હોવા છતાં જે તે દેશો વિકાસની આંધળી દોડમાં વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. ત્યારે ગ્લોબલ ફોરેસ્ટ વોચ કે જે વિષુવૃત પાસે આવેલા જંગલો કે જેને ટ્રોપિકલ ફોરેસ્ટ કહેવામાં આવે છે તે જંગલો સહિતના જંગલોનું અધ્યયન કરતું રહે છે. કારણ આ ગાઢ જંગલોનો ધરતી પરનું વાતાવરણ સાચવવામા મહત્વનો ફાળો છે. જ્યારે કે વિશ્વના દેશો આ જંગલોને ઓક્સિજનની ફેક્ટરી કહે છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે ૨૦૨૦ માં સમગ્ર વિશ્વમાંથી ૧,૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર જંગલો કપાયાં છે. અને આ અહેવાલ ગ્લોબલ ફોરેસ્ટ વોચ એ જાહેર કરેલ છે. આ વૃક્ષો કાપી નાખલા ગાઢ જંગલો પૈકી ત્રીજા ભાગના જંગલો એવા હતા કે જ્યાં માનવ પ્રવૃત્તિઓ ખાસ હતી જ નહીં એટલે કે સાચા અર્થમાં ગાઢ જંગલો હતા. અને તેનુ નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જોકે જે તે દેશોમાં માનવ વસાહતો ઊભી કરવામાં આવે છે ત્યા ઊભેલા ગાઢા વૃક્ષોને પણ કાપી નાખવામાં આવે છે. ત્યારે માનવજાત એ નથી વિચારતી કે વૃક્ષો માનવીઓને ઓક્સિજન આપે છે, અને ગરમીના સમયમાં એવી સ્થિતિ બને છે કે વૃક્ષ કાપી નાખ્યા પછી છાંયો લોકો છાંયો શોધતા હોય છે ! વૈશ્વિક સંસ્થા ગ્લોબલ ફોરેસ્ટ વોચ ના અહેવાલ અનુસાર કપાયેલા જંગલો પૈકી ૪૨ હજાર ચોરસ કિલોમીટર જંગલો પ્રાઇમરી હતાં. જે કપાતા તેના દ્વારા શોષાતો કાર્બન હવામા ફેલાશે જેનુ વાર્ષીક પ્રમાણ ૨.૬૪ અબજ ટન જેટલું થાય છે. ભારતમાં ૨૦૨૦ દરમિયાન ૩૮૫ ચોરસ કીલોમીટર જંગલો કપાયાં હતા. આ આંકડો ગાઢ જંગલોનો છે જ્યારે કે માનવીય પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાંના આપવામાં આવેલ વૃક્ષો અલગ. વિશ્વમાં સૌથી વધુ જંગલો કાપવામાં રશિયા પ્રથમ ક્રમે છે અને ઇન્ડોનેશિયા સૌથી ઓછા ક્રમે વૃક્ષો કાપવામા છે. વિવિધ દેશો પૈકી મેક્સિકોએ ૬૮૦ ચોરસ કિલોમીટર જંગલો કાપી નાખ્યા છે, મલેશિયાએ ૭૩૦ ચો.કિલોમીટર, લાઓસમા ૮૨૦ તો. કિલોમીટર, કેમેરોન- ૧૦૦૦, કોલંબિયા- ૧૬૬૦, પેરુ ૧૯૦૦, ઈન્ડોનેશિયા- ૨૭૦૦, બોલિવિયા- ૨૭૬૦, કોંગો- ૪૦૦૦, બ્રાઝિલ-૧૭૦૦૦, પેરાગ્વે- ૬૩,૦૦૦, મલેશિયા- ૮૪,૦૦૦, ઓસ્ટ્રેલિયાએ ૮૫,૦૦૦ ચોરસ કિલોમીટર જંગલોનો સફાયો કરી નાખ્યો છે. જ્યારે કે સૌથી વધુ જંગલોનુ નિકંદન કાઢી નાખવામાં આવ્યુ તેમાં ચીન- ૧,૦૩,૦૦૦ ચોરસ કિલોમીટર, કોંગો- ૧,૫૯,૦૦૦, ઇન્ડોનેશિયા- ૨,૭૭,૦૦૦,

મલ્ટી સેલર ફ્લેક્સ ઉદ્યોગસાહસિકોને એમેઝોન ઇકોસિસ્ટમમાં સ્થાનિક વ્યવસાયિક તકો હાંસલ કરવા મદદરૂપ બનશે ટિયર ર અને તેની નીચેના નગરો સહિત સમગ્ર ભારતના સેલર્સ તેમની પ્રોડકટસના લિસ્ટિંગ ઉપર પ્રાઇમ બેજ મેળવી શકે છે પ્રાઇમ ડે પહેલાં એમેઝોન ઇન્ડિયાએ આજે મલ્ટી-સેલર ફ્લેક્સ લોંચ કરવાની જાહેરાત કરી છે, જેનાથી ટિયર ૨ અને નીચેના નગરોના સેલર્સ તેમની લિસ્ટિંગ્સ ઉપર પ્રાઇમ બેજ હાંસલ કરવા માટે સક્ષમ બનશે. એમએસએફનો ઉપયોગ દ્વારા ટિયર ૨ અને તેની નીચેના નગરોમાંથી મોટી સંખ્યામાં સેલર્સ ઇકોમર્સ સાથે જોડાઇ રહ્યાં છે ત્યારે અમે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ સાથે ભાગીદારી કરી રહ્યાં છીએ, જેઓ મલ્ટી સેલર ફ્લેક્સ સાઇટ્સની માલીકી અને સંચાલન માટે આવક પ્રાપ્ત કરવાના લાભો મેળવી શકે તથા ટિયર ૨ અને નીચેના નગરોના સેલર્સ દેશભરના ગ્રાહકોને વેચાણ કરવા માટે એમેઝોન પ્રાઇમના લાભો પ્રાપ્ત કરવા સક્ષમ બની શકે. એમએસએફના લોંચથી માર્કેટપ્લેસ ઉપર સેલર્સ પ્રોડક્ટ લોંચનો સમય પણ નોંધપાત્ર ઘટશે તથા સંચાલકીય ખર્ચ પણ નોંધપાત્ર ઘટાડવામાં મદદરૂપ બનશે. આ લાભો એસએમબીને ડિજિટાઇઝેશન માટે મદદ કરી શકે છે કે જેઓ ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા

(અનુસંધાન પાન નં. ૨)

સ્વીટીના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું, થોડા દિવસમાં જ આ કેસ રાજ્યની બે મહત્ત્વની એજન્સી કાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગૃમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી.ચુડાસમાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદઅમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે પહોંચી હતી. અને અત્યારસુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી

ગ્રાહકોના વિશાળ આધારની એક્સેસ અને સેવાઓ પ્રદાન કરવાની ઇચ્છા ધરાવે છે, તેમ એમેઝોન ઇન્ડિયા ખાતે સેલર ફ્લેક્સના ડાયરેક્ટર શ્રીકાંત શ્રીરામે જણાવ્યું હતું. આ લોંચ એમેઝોનને ગ્રાહકોને પ્રાઇમ સેક્શન ઓફર કરવામાં તેમજ પ્રાઇમ મેમ્બર્સ માટે ઝડપી ડિલિવરી માટે સક્ષમ બનાવશે. આ સાથે ટિયર ૨ અને તેની નીચેના નગરોમાં હજારો પરોક્ષ રોજગાર અને ઉદ્યોગસાહસિકતાના સર્જન માટે પણ શક્ય બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું. મલ્ટી સેલર ફ્લેક્સ પ્રોગ્રામથી અમારી પ્રોડક્ટ્સ માટે પ્રાઇમ બેજ મેળવવામાં મદદ મળી છે. તેના પરિણામે ગ્રાહકોને ઝડપી ડિલિવરી થઇ શકે છે અને તેનાથી અમે મેળવતા ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. કોલ્રાયમ વિસ્તારમાં એમએસએફ સાઇટથી પરિવહન અને વેરહાઉસિંગ સંબંધિત સંચાલકીય ખર્ચ મર્યાદિત બન્યો છે, જેના પરિણામે અમે વધ્ નફો મેળવી શક્યાં છીએ. વધુમાં એમેઝોનના વિશ્વસ્તરીય લોજસ્ટિક અને સપોર્ટ નેટવર્ક દ્વારા ડિલિવરીના સંચાલનથી અમે પ્રોડકટ ઇનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં છીએ તેમજ વ્યવસાયની બીજી પ્રક્રિયાઓ સરળ બની છે, તેમ રેઇનટેક ઓનલાઇન સ્ટોરના પ્રોપરાઇટર શ્રૃતિ કે પ્રિન્સે જણાવ્યું હતું. મલ્ટી સેલર ફ્લેક્સ સાઇટની સ્થાપના માટે

પાસેથી તપાસના કાગળો લીધા હતા. એ બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો. મુંક્રાઇમ બ્રાચની ટીમે તપાસ હાથ પર લીધા બાદ રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ પી.આઇ. એ.એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. એ બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરૂ મકાનમાં પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં એ જગ્યા અને મકાનનું પંચનામું કર્યું હતું. પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે પીઆઇ અને સ્વીટીની વ્હોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે

એમેઝોન ઇન્ડિયા સાથે ભાગીદારી કરવાથી મને આવકન વધારાના સ્રોતો મળ્યાં છે અને ૧૦ વ્યક્તિઓની સપોર્ટ ટીમ છે. એક એમએસએફ ઓપરેટર તરીક હું મદ્દરાઇ અને તેરૂનેવેલેઇની આસપાસના સ્થળોના નાના વ્યવસાયોને દેશભરમાં તેમની પ્રોડક્ટ્સનું વેચાણ કરવા સક્ષમ બનાવવા સમર્થ બન્યો છું, જેનાથી રોજગારની તકોનું સર્જન થયું છે અને સ્થાનિક અર્થતંત્રને ટેકો મળ્યો છે. આ પ્રોગ્રામની મદ્દરાઇમાં વિસ્તારમાં રહેતાં લોકોના જીવન ઉપર થયેલી અસરોને જોતા ખુશી અનુભવાય છે, તેમ અબીરામી લોજસ્ટ્રિક્સના મેનેજિંગ પાર્ટનર ચંદ્રુએ જણાવ્યું હતું. આ વખતે પ્રાઇમ ડે ઉપર સ્ટાર્ટઅપ્સ અને બ્રાનુડ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, કલાકારો અને વણકરો સહિતના ૧૦૦થી વધુ સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ વિવિધ કેટેગરીમાં ૨,૪૦૦થી વધુ પ્રોડક્ટ્સ તેમજ ૭૫,૦૦૦થી વધુ નજીકના ઓફલાઇન શોપ્સ પ્રાઇમ ડે ઉપર ડેબ્ય કરી રહ્યાં છે. એમેઝોન આર્થિક વિક્ષેપમાંથી બાઉન્સ બેક થવા માટે લાખો સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસિસ (એસએમબી)ને સક્ષમ અને સપોર્ટ કરવાનુ જાળવી રાખશે, જેથી લાખો સેલર્સ, મેન્યુફ્રેક્ચરર્સ, સ્ટાર્ટ-અપ્સ અને બ્રાન્ડ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો, કલાકારો અને વણકરો તેમજ સ્થાનિક દુકાનો તરફથી ઓફર કરાતી પ્રોડક્ટ્સ માટે ગ્રાહકોની માગ પેદા કરી શકાય.

લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વ્હોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વ્હોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી હતી. વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં **કરજ બજાવનાર પીઆઇ** એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલા ૪૯ દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા ૩ માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં.

अभे अोन धन्डियाओ मस्टी-इषिमां ह्यामान इरहारनी असर अने ते अंगेनी प्युह्रयनाः मुज्य आधार ह्यामान

કૃષિ ઉત્પાદનનો મુખ્ય આધાર હવામાન ઉપર રહેલો છે. જો હવામાન પાક માટે અનુકૂળ હોય તો ઉત્પાદન સારૂ મળે છે. અન્યથા પ્રતિકૂળ હવામાન કે હવામાનમાં ફેરફાર થાય તો પાક ઉત્પાદન ઉપર તેની સીધી અસર થતા ઉત્પાદન ઘટે છે. હવામાનમાં થતાં પરિવર્તનની અસર વિવિધ પાકો, પશુઓ, સ્થાનિક કૃષિ અર્થકરણ અને પાક ઉત્પાદનના પ્રમાણ ઉપર અસર થવા પામે છે. આમ હવામાનએ ખેડૂતોની ખેતી અને તેમના જીવન ઉપર અસર કરતું મુખ્ય પરિબળ છે. હવામાન ફેરફાર એ ઉપરના સઘળા જીવન માટે સ્વૈશ્વિક ધોરણે વાતાવરણીય, સામાજીક અને આર્થિક રીતે હાનિકારક અસર કરે છે. જેનો સામનો આજે આખ્ વિશ્વ કરી રહયું

વૈશ્વિક તાપમાનમાં વધારો,

તેજાબયુકત વરસાદ, ઓઝાનના સ્તરમાં ઘટાડો, પુર, દુષ્કાળ, વંટોળ, ગરમીના મોજા, ગરમ ઉનાળો, ભારે વરસાદ, સુનામી વગેરેની નકારાત્મક અસરો કૃષિ ઉત્પાદન અને માનવ જીવન ઉપર થાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થવા માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ખેતીમાં થયેલ વધારાે છે. સને ૯૦૧– ૨૦૦૦ના ૧૦૦ વર્ષ દરમ્યાન તાપમાનમાં ૦.૪ સે. નો વધારો થવા પામેલ છે. એક અંદાજ મુજબ ૨૧મી સદીના અંત સુધીમાં સરેરાશ વાર્ષિક તાપમાનમાં ૩થી ૬ સે.નો વધારો થવા પામશે તો વરસાદના પ્રમાણમાં ૧૫થી ૪૦ ટકાનો ઘટાડો થવા પામશે. તાપમાન અને વરસાદના પ્રમાણમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો તેની નોંધપાત્ર અસર કળો, શાકભાજી, ચા,કોફી, સુગંધિત અને ઔષધિય પાકો વગેરેની ગુણવત્તા ઉપર થવા પામે છે. ઘઉંના પાકને તો તાપમાનમાં સામાન્ય વધારો થાય તો પણ તરતજ અસર થાય છે. સર્વે ઓફ ઈન્ડીયન એગ્રિકલ્ચર (૨૦૦૭)માં જણાવ્યા મુજબ રાસાયણિક ખાતરોનો વધ્ પડતો વપરાશ ગ્રીનહાઈસ

ખેતીનું પ્રમાણ વધારે છે. કૃષિને થતી હવામાન કેરકારની અસરોઃ ૧. પાકના ઉત્પાદનમાં ઘટાડો થવા પામે છે. ૨. હવામાન ફેરફારથી રવી ઋતુનો ગાળો ટુંકો થવાથી રવી પાકોનો ઉત્પાદનમાં ઘટાડો થવા પામે છે. ૩. હવામાનમાં પ્રતિકળતાને પરિણામે રોગ-જીવાતનો ઉપદ્રવ વધવા પામે છે. ૪. ઉંચા તાપમાનને કારણે ઉત્પાદનની ગુણવત્તાને અસર થવા પામે છે. પ. તાપમાનમાં

દાણાનું વજન તથા એમાયલેઝનં પ્રમાણ ઘટે છે. અને દાણાની લંબાઈ તથા સુગંધને અસર થાય છે. ૬. તાપમાનમાં વધારો

વધારો થાય તો ચોખાની

બાસમતી જાતમાં ૧૦૦૦

થવાથી દ્ધાળા પશુઓના દૂધ ઉત્પાદન પર અસર થાય છે. ૭. ભારતમાં થતા હવામાન ફેરફારને કારણે સને ૨૦૨૦ સુધીમાં અંદાજે ૧૮ લાખ ટન દૂધ ઉત્પાદન ઘટશે તેમ એક અભ્યાસમાં જણાવેલ છે. તેજ રીતે હવામાન ફેરફારને કારણે સને ૨૦૫૦માં ૧૧૭ લાખ ટન અને ૨૦૮૦માં ૨૩૫ લાખ ટન ઘઉંનું ઉત્પાદંન ઘટવા પામશે. કૃષિ ક્ષેત્ર પર થનાર ઉપરોક્ત અસરોને ધ્યાને લઈ વાતાવરણીય ફેરફાર સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પડશે. ખેતર લેવલ વધુ સાનુકૂળ આવે તેવી પાકની જાતો શોધવી પડશે કે જેના ઉપર હવામાન ફેરફારની ઓછી અસર થવા

ખેડૂતોના ખેતર પર હાથ ધરી શકાય તેવા ઉપાયોઃ મોડી વહેલી પરિપકવ થતી જાતો વાવવી, પાકની ફેરબદલી કરવી કે પાક આયોજનમાં ફેરફાર કરવો. પાકની વહેલી વાવણી કરવી, ખેતી કાર્યોના સમયમાં સાનુકળ ફેરફાર કરવા, યોગ્ય ખેડ કાર્યો મારફતે જમીનમાં ભેજનું સંરક્ષણ કરવું, પિયતની

કાર્યક્ષમતા સુધારવી કે તેમાં વધારો કરવો, ખેતીમાં રોકેલ મૂડી, મજૂરી અને જમીનને ધ્યાને લઈ આર્થિક ફાયદો થાય તે રીતે આયોજન કરવું જોઈએ. હવામાન ફેરફારને ધ્યાને લઈ વધ્ તાપમાન તથા સુકી પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી જાતો સંવર્ધન થકી વિકસાવી તેનો ખેતીમાં ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય નીચેના ઉપાયો પણ હાથ ધરી શકાય. ૧. તાપમાન કાર્બન ડાયોકસાઈડ અને ગરમીમાં થતા ફેરફાર સામે ટકી શકે તેવી ટ્રાન્સજેનિક પાકો વિકસાવવા, ર. હવામાન ફેરફારની સાથે તેને અનુકૂળ પાકનું ચક્ર, વાવણી, રોપણી, અંતર તથા ઈનપૃટસની વ્યવસ્થા ગોઠવવી. ૩. વિવિધ ખેત હવામાન વિભાગોમાં ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ કરી પાણીનું સંરક્ષણાત્મક ઉપયોગ કરવો. ૪. વનોનું સંરક્ષણ, જમીનની જાળવણી, રક્ષને આગળ વધતાં અટકાવવા વગેરે ઉપાયો દ્વારા હવામાનમાં થતા કેરકારને ઘટાડી શકાય.

હવામાન ફેરફારને અંકુશમાં લેવા માટેની વ્યવસ્થાપન વ્યૂહરચનાઃ ૧, હવામાનની આગોતરી જાણકારી પ્રી પાડવીઃ ખેડૂતો પરંપરાગત રીતે ઋતુ મુજબ પાકોની ખેતી કરતા હાય છે. ખેડૂતો હવામાનની આગોતરી જાણકારીનો મર્યાદિત ઉપયોગ કરે છે. તેથી વિભાગ મુજબ વરસાદ, તાપમાન, ભેજ વગેરેની હવામાન અંગેની આગોતરી માહિતી ખેડૂતોને પૂરી પાડવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી હવામાન ફેરફારની ખેડૂતોને જાણકારી મળી શકે.

ર. ઉજાના ઉપયોગ માટે યોગ્ય નીતિ ઘડવીઃ ખેતીના ઈનપ્ટસમાં વિજળીની બચત માટે કે તેનો ઉપયોગ મર્યાદિત કરવા માટે સબસિડી આપવી જોઈએ.

૩. પિયતના પાણીની બચતઃ આ માટે યોગ્ય તાત્રિકતાની પસંદગી, ખેડત ઋત અને પાક મુજબ ભૌતિક અને આર્થિક રીતે અપનાવી શકે તેવી તાંત્રિકતાનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ કે જેથી પિયતના પાણીની બચત થઈ શકે.

ICICI Bank

CIN-L65190GJ1994PLC021012 Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara - 390 007. Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051. Phone: 022-26538900, Fax: 022-26531230, Email: investor@icicibank.com

Website: www.icicibank.com FINANCIAL RESULTS

| | (₹in crore) | | | | | | | |
|-----|--|-------------------------------|-------------|--------------------|--------------|-------------|------------|--|
| Ш | | STANDALONE | | | CONSOLIDATED | | | |
| Ш | | Three months ended Year ended | | Three months ended | | Year ended | | |
| Sr. | Particulars | June | June | March | June | June | March | |
| no. | | 30,2021 | 30,2020 | 31,2021 | 30,2021 | 30,2020 | 31,2021 | |
| II | | (Q1-2022) | (Q1-2021) | (FY2021) | (Q1-2022) | (Q1-2021) | (FY2021) | |
| | | (Unaudited) | (Unaudited) | (Audited) | (Unaudited) | (Unaudited) | (Audited) | |
| 1. | Total income from operations (net) | 24,379.27 | 26,066.95 | 98,086.80 | 38,852.60 | 37,939.32 | 161,336.48 | |
| 2. | Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 6,042.71 | 3,182.50 | 20,182.72 | 6,678.59 | 4,587.30 | 26,028.33 | |
| 3. | Exceptionalitems | | | | | | | |
| 4. | Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 6,042.71 | 3,182.50 | 20,182.72 | 6,678.59 | 4,587.30 | 26,028.33 | |
| 5. | Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 4,616.02 | 2,599.15 | 16,192.68 | 4,747.42 | 3,117.68 | 18,384.32 | |
| 6. | Total comprehensive income for the period [Comprising profit/(loss) for the period (after tax) | | | | | | | |
| | and other comprehensive income (after tax)] (refer note no. 5) | N.A. | N.A. | N.A. | N.A. | N.A. | N.A. | |
| 7. | Paid-up equity share capital (face value ₹ 2 each) | 1,385.22 | 1,295.41 | 1,383.41 | 1,385.22 | 1,295.41 | 1,383.41 | |
| 8. | Reserves excluding revaluation reserves | 147,894.71 | 114,205.75 | 143,029.08 | 158,070.47 | 121,705.39 | 153,075.71 | |
| 9. | Earnings per share (EPS): | | | | | | | |
| | Basic EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹) | 6.67 | 4.01 | 24.01 | 6.86 | 4.82 | 27.26 | |
| | Diluted EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹) | 6.54 | 3.98 | 23.67 | 6.72 | 4.76 | 26.83 | |
| | Notes | | | | | | | |

Notes:

1. During FY2021, the Covid-19 pandemic resulted in a nation-wide lockdown in April-May 2020 which substantially impacted economic activity. For the banking sector, these developments resulted in lower demand for loans and fee-based services and regulatory measures like moratorium on payment of dues and standstill in asset classification to mitigate the economic consequences on borrowers. It also resulted in increase in provisioning reflecting higher actual and expected additions to nonperforming loans. The easing of lockdown measures subsequently led to gradual improvement in economic activity and progress towards normalcy from the second half of FY2021

The second wave of the Covid-19 pandemic in April-May 2021 led to the re-imposition of localised/regional lock-down measures in various parts of the country. In the $absence\ of\ regulatory\ dispensations\ like\ moratorium\ on\ loan\ repayments\ and\ standstill\ on\ asset\ classification, the\ impact\ on\ the\ quality\ of\ the\ loan\ portfolio\ would\ like\ loan\ portfolio\ would\ like\ loan\ portfolio\ would\ like\ loan\ portfolio\ would\ like\ loan\ portfolio\ portfolio\ loan\ portfolio\ loan\ portfolio\ portfolio\ loan\ portfolio\ portfolio\$ be sharper and earlier during fiscal 2022. The second wave has started to subside from June 2021 onwards and there has been a gradual lifting of lock downs, resulting in

The Bank made net Covid-19 related provision of ₹ 4,750.00 crore in FY2021 and held an aggregate Covid-19 related provision of ₹ 7,475.00 crore at March 31, 2021. During Q1-2022, the Bank wrote-back Covid-19 related provision of ₹ 1,050.00 crore based on the updated position of various portfolios underlying these provisions (made Covid-19 related provision of ₹5,550.00 crore in Q1-2021) and accordingly held Covid-19 related provision of ₹6,425.00 crore at June 30,2021. The impact, including with respect to credit quality and provisions of the Covid-19 pandemic on the Bank and the Group, is uncertain and will depend on the traiectory of

the pandemic, progress and effectiveness of the vaccination programme, the effectiveness of current and future steps taken by the government and central bank to

- mitigate the economic impact, steps taken by the Bank and the Group and the time it takes for economic activities to return to pre-pandemic levels. 2. In Q1-2022, the Bank has changed its provisioning policy on non-performing advances to make it more conservative. The aforementioned change resulted in higher provisions on non-performing advances amounting to ₹1,127.15 crore in Q1-2022.
- During Q1-2021, the Bank sold equity shares in its subsidiaries and made a net gain of ₹3,036.29 crore in standalone financial results and ₹2,715.87 crore in consolidated financial results (during FY2021: net gain ₹3,669.94 crore in standalone financial results and ₹3,297.05 crore in consolidated financial results).
- During Q1-2022, the Bank has allotted 9,044,970 equity shares of ₹2 each pursuant to exercise of employee stock options.
- The Indian Accounting Standards (Ind AS) are currently not applicable to banks in India.

Note: The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results is available on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and the Bank's website (www.icicibank.com)

For and on behalf of the Board of Directors

Mumbai July 24, 2021

Vishakha Mulye **Executive Director** DIN-00203578

પ્રથમ મેચમાં ભારતનો વિજય

टोडयोगां लारतनो होडीमां न्यूअितेन्ड साभे उ-२थी विश्व

ભારતીય હોકી ટીમે ટોક્ચોમાં જીતથી શરૂઆત કરી છે. એક ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરનારી ભારતીય ટીમે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરતા ગ્રુપ-એનો આ ગોલમાં બદલવા દીધી ન હતો. ન્યૂઝેલેન્ડે માટે છક્રી મિનિટે પેનલ્ટી કોર્નર વિશેષજ્ઞ કેન રસેલે ગોલ કર્યો હતો. ભારત માટે રૂપિન્દર પાલ સિંહે ૧૦મી મિનેટે પર પેનલ્ટી સ્ટ્રોક

ટોક્ચો,તા.૨૪ પર ગોલ કર્યો હતો. ડ્રેગ ફ્લિપર ઓગસ્ટના રોજ, ત્રીજી ઓગસ્ટના હરમનપ્રીત સિંહે ૨૬મી અને ૩૩મી મિનિટે ગોલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે બીજો ગોલ ૪૩મી કરતા ભારતીય પુરુષ હોકી ટીમે મિનિટ પર સ્ટીફન જેનિસે કર્યો ગોલકીપર પીઆર શ્રીજેશના હતો. હોકીમાં ભારતને ૧૯૮૦ શાનદાર પ્રદેશનની મદદથી પછી કોઈ મેડલ નથી મળ્યો. ન્યૂઝીલેન્ડને ૩-૨થી હાર આપી છે. ભારતીય હોકી ટીમ ૨૫મી આ સાથે જ ટીમ ટોક્યો જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા સામે ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત બીજી મેચ રમશે. ઓસ્ટ્રેલિયાએ પણ કરી છે. છેલ્લા ચાર દશકામાં જીત સાથે રમતની શરૂઆત કરી ઓલિમ્પિક પદક જીતવાનો પ્રયાસ છે. ટીમે યજમાન જાપાનને પ-૩થી હાર આપી હતી. ગ્રુપ-એમાં ભારત, ઓસ્ટ્રેલિયા, મુકાલબો જીતી લીધો છે. અનેક આર્જેન્ટીના, સ્પેન અને જાપાન છે. વીડિયો રેફરલ સાથે રમવામાં જ્યારે ગ્રુપ-બીમાં બેલ્જિયમ, કેનેડા, આવેલી આ મેચમાં આખરી જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને મિનિટોમાં ન્યૂઝીલેન્ડને પેનલ્ટી જર્મન છે. બંને ગ્રુપની ટોપ ટીમને કોર્નર મળ્યો હતો, જેને શ્રીજેશે ક્વાર્ટર ફાઇલમાં જગ્યા મળશે. હૉકીમાં ગ્રુપ સ્ટેજની રમત ૨૪મી જુલાઈથી શરૂ થઈ છે. ગ્રુપ સ્ટેજની મેચો ૩૦મી સુધી ચાલશે. ૧ ઓગસ્ટથી નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે. ક્વાટર ફાઇનલ પહેલી

રોજ સેમીફાઇનલ જયારે ફાઇનલ પાંચમી ઓગસ્ટના રોજ યોજાશે. ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો આર્જેન્ટીનાએ ગોલ્ડ મેડલ, બેલ્જિયમે સિલ્વર અને જર્મનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લગ્ન કરવાને ઈરાદે સગીરાનું અપહરણ

વડોદરા, તા.૨૪ વડોદરાના શિનોર તાલુકાના કોથીયપુરાના રહીશ લાલજીભાઈ ચંદુભાઈ વસાવાની પુત્રીનું તા.૦૫-

૦૭-૨૦૨૧ના રોજ મેહુલ ભીલ દ્વારા લગ્ન કરવાના ઇરાદે પટાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે. ગુમ થનાર ઘઉંવર્ણી, શરીરે મજબૂત **બાંધાની અને આશરે ૧૬૩ સે.મી.** ઉંચાઈ છે. તે ગુજરાતી ભાષા જાણે છે. તેના જમણા હાથમાં ગુજરાતીમાં કાજલ ત્રોફાવેલું છે.

બારેજામાં મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટથી

ઈજા પામેલામાંથી સારવાર દરમિયાન વધ્ એકનું भोत, इस मृत्युआं ८ थयं

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૨૪ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર પતરાંના મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારનાં સાત લોકોનાં મોત થયાં હતાં. મંગળવારે રાતે બનેલી ઘટનામાં ગુરુવારે સારવાર દરમિયાન ત્રણ, શુક્રવારે ચાર અને આજે સવારે વધુ એક મહિલા સીમાબાઈ અહીરવાર (ઉં.વ.૨૫)નું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક ૮ પર પહોંચ્યો છે. ઘટનાનો ભોગ બનેલા મધ્યપ્રદેશના પરિવારમાં શોક ફેલાયો છે.

આ ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અસલાલી પોલીસ ના જણાવ્યા અનુસાર, પરિવાર મકાનમાં સુતો હતો અને ગેસ-લીકેજથી બ્લાસ્ટ થતાં ૭ લોકોનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. આજે વધુ એકનું મોત થયું છે. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. દસક્રોઈ તાલુકાના બારેજા-મહિજડા રોડ પર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પરિવાર પતરાંના મકાન બનાવીને રહેતા હતા.

મંગળવારે રાતે પરિવારના મકાનમાં ગેસ-સિલિન્ડર ચાલુ રહેતાં લીકેજ થયું હતું. પાડોશમાં રહેતા પરિવારને ગંધ આવતાં તેમણે દરવાજો ખખડાવ્યો હતો અને એમાં ઘરમાંથી લાઈટ ચાલુ કરતાં જ મોટો બ્લાસ્ટ થયો હતો. ઘરમાં સૂતેલાં ૪ બાળકો સહિત ૧૦ લોકોને ગંભીર ઇજા થઇ હતી. ઘરનાં પતરાં ઊડી ગયાં હતાં. બધો સામાન ઘરની બહાર ઊડીને પડ્યો હતો. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અસલાલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સારવાર દરમિયાન ૭ લોકોનાં આ ઘટનામાં મોત થયાં હતાં. મૃતકોમાં રામપ્યારી બાઈ અહિરવાર (ઉં. વ. ૫૬), રાજુભાઈ અહિરવાર (ઉં. વ. ૩૧), સોનુ અહિરવાર (ઉં. વ. ૨૧), વૈશાલી બેન અહિરવાર (ઉં. વ. ૭), નિતેશ ભાઈ અહિરવાર (ઉં. વ. ૬), ઘટનાની તપાસ શરૂ કરી છે.

પાયલ બેન અહિરવાર (ઉં. વ. ૪), આકાશ ભાઈ અહિરવાર (ઉં. વ. ૨)નો સમાવેશ થાય છે અને આજે અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક મહિલા સીમાબાઈ અહીરવાર (ઉં.વ.૨૫)નું મોત થયું હતું.

તમામ શ્રમજીવી મધ્યપ્રદેશથી રોજીરોટી અર્થે ગુજરાતમાં આવ્યા હતા. અહીં ફેક્ટરીમાં કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં કેન્દ્ર સરકારના તાજેતરમાં જ કેબિનેટ પ્રધાન બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને આ મામલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાને રાહતની જાહેરાત કરતા મતકોને ૪ લાખ જ્યારે બાળકોનાં પરિવારને ૨ લાખ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત તમામની સારવાર મફત કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસે એફએસએલની મદદથી આ સમગ્ર

રેમડેસિવિરનાં કાળાબજાર મુદ્દે હાઈકોર્ટના સરકારને તીખા સવાલો

પરિવાર માટે ઇન્જેક્શન લઈ જનાર અને પૃહજાર

(પ્રતિનિધિ) અમદાવાદ,તા.૨૪ કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારના કેસમાં ભરૂચની ચાર વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયતને પડકારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને તીખા સવાલો કર્યા હતા. હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સરકારને ટકોર કરી હતી કે, પરિવાર માટે બે રેમડેસિવિર ઇન્જેક્શન લઇ જતા સામાન્ય માણસને પકડીને તેની સામે પાસા લગાવી દેવામાં આવે છે તો પાંચ હજાર ઇન્જેક્શન લઇને બીજા શહેરમાં વહેંચી દેનાર રાજકીય પાર્ટીના સિનિયર નેતા વિશે સરકાર પાસે શું ખુલાસો છે? તેનો જવાબ નાગરિક પુરવઠા વિભાગ આપશે કે સરકાર? શું આ બાબતને પણ જાહેરહિતની અરજી સાથે જોડી દેશો? બહેન માટે ઇન્જેક્શન લઇ જનાર સામે પાસા કેવી રીતે કરો? તેને જેલમાં નાખવાનો? અને ૧ હજાર ઇન્જેક્શન વેચનારને હાર-તોરા? ભરૂચની ચાર વ્યક્તિની રેમડેસિવિર ઇન્જેક્શનના

કાળાબજારના કેસમાં પાસા હેઠળ ધરપકડ કરી હતી. અહીં નોંધવું ઘટે કે, હાઇકોર્ટમાં ભરૂચના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે ચાર વ્યક્તિ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક મોર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેસન્સિયલ કોમોડિટી એક્ટ હેઠળ પાસા લગાવીને ધરપકડ કરતાં, ચારેયે પાસાનો ગુનો રદ કરવા અરજી કરી છે. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારની

ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આખરી નિકાલ આવે નહીં ત્યાં સુધી ભરૂચના ચારે જણ સામે પાસાનો હકમ રદ કરવાનો આદેશ પણ કર્યો હતો. મહત્વનું છે કે, કોરોનાના નવા વેરિયેન્ટ અણધાર્યા હોવાથી ત્રીજી લહેર અચાનક ત્રાટકી આફત ઉભી ન કરે તે માટે લોકો અને સરકાર બન્ને સાવધાન રહેવા અને તકેદારી રાખવા ગુજરાત હાઇકોર્ટે સૂચન કર્યું છે.



વડોદરા મહાનગરપાલિકા

www.vmc.gov.in રેન્ડર નોરીસ

વડોદરા મહાનગરપાલિકામાં યોગ્ય વિભાગ તેમજ યોગ્ય શ્રેણીમાં નોંધાયેલ માન્ય ઇજારદારો પાસેથી ાથા અરકારી/અર્ધઅરકારી અંસ્થાના નોંધાયેલા અનુભવી ઇજારદારો પાસેથી નીચે જણાવેલ ક

| માટે મહોરબંધ ભાવપત્રો મંગાવવામાં આવે છે. | | | | | | |
|--|--------------------|-------------------|-------------|--------------------|--|--|
| અ.ઌં. | પી.આર.ઓ.નંબર | વિભાગનું નામ | કામનીસંખ્યા | અંદાજીત રકમ | | |
| 9 | 3२3/२१-२२ | રોડ પ્રોજેકટ | 09 | १४,७५,५००/- | | |
| ૨ | ૩ ૨૪/૨૧ −૨૨ | બિલ્કીંગ પ્રોજેકટ | 09 | 3,96,400/- | | |
| 3 | ૩૨૬/૨૧-૨૨ | રોડ પ્રોજેકટ | 03 | 3,94,00,000/- | | |
| γ | 3 ૨૭/૨ ૧-૨૨ | રોડ પ્રોજેકટ | 04 | 9,93,40,000/- | | |
| ч | <i>3</i> ₹८/२१−२२ | એન્ટ્રલ વર્કશોપ | 94 | ક,∈પ,૪૫ક/ <i>-</i> | | |
| G | 326/29-22 | પા.પ.(ઇલે.મિકે.) | 09 | 34,00,000/- | | |

નોંધ: અ.નં. ૧, ૩, ૪ અને ૬ ની બહેરાત ઇ-ટેન્ડરીંગની છે. પરોક્ત કામના ટેન્ડર ફ્રોર્મ તથા વિસ્તૃત માહિતી જે તે સંબંધિત વિભાગમાંથી ઉપરોક્ત સૂચિત ાબસાઇટ પરથી મળી રહેશે. કોઇપણ ભાવપત્ર મંજુર/નામંજુર કરવાની અબાધિત સત્ત યુનિસિપલ કમિશનસ્ત્રીની રહેશે જનસંપર્ક વિભાગ વ્હારા પ્રકાશિત .આર.ઓ.નં.330/૨0૨૧-૨૨

પશ્ચિમ રેલવે હારા બાન્દ્રા ટર્મિનસ 与 જબલપુર વચ્ચે દોડતી સુપરફાસ્ટ તહેવાર વિશેષ ટ્રેનની સેવાઓ લંબાવાઈ

| ट्रेन नं. | મૂળ સ્ટેશન અને ગંતવ્ય સ્થળ | સેવાના દિવસ | વિસ્તરણની વિગત |
|-----------|---------------------------------------|-------------|---------------------------|
| 05433 | બાન્દ્રા ટર્મિનસ - જબલપુર (સાપ્તાહિક) | શનિવાર | ૧ લી જાન્યુઆરી, ૨૦૨૨ સુધી |
| ०२९३४ | જબલપુર - બાન્દ્રા ટર્મિનસ (સાપ્તાહિક) | શુક્રવાર | ૩૧ મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી |

રોકાણ સંબંધિત વિગતવાર સમય માટે કૂપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લો.

ફક્ત આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

મુસાફરોને બોર્ડિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન અને લક્ષ્યસ્થાન દરમિયાન તમામ ધોરણો, COVID-19 થી સંબંધિત એસ. ઓ.પી.નું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે

લંબાવાચેલ ટ્રેન નંબર ૦૨૧૩૩નું બુકિંગ ૨૬ જુલાઈ, ૨૦૨૧થી નામાંકિત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ વિશેષ ભાડાની વિશેષ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.







બધી આરક્ષિત ટિકિટો માટે ઓળખપત્ર સાથે રાખો

પશ્ચિમ રેલવે તેજસ એક્સપ્રેસ W.E.F. હમી ઓગસ્ટ, ૨૦૨૧થી મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ વચ્ચે પુનઃ દોડાવશે

| ड्रेन नं. | પ્રાંરભનું સ્ટેશન અને ગંતવ્ય | સેવાના દિવસો | ઉપકશે | પહોંચશે |
|--------------|------------------------------|--|-------------|---------------------------|
| ८२६०१ | મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ | શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર | ૧૫.૪૫ કલાકે | ૨૨.૦૫ કલાકે (એજ દિવસે) |
| CSEOS | અમદાવાદ - મુંબઇ સેન્ટ્રલ | શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર | ०५.४० કલाકे | ૧૩.૦૫ કલાકે (એજ દિવસે) |

રોકાણના સ્ટેશનો : અંધેરી, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડીયાદ સ્ટેશનો પર બંને તરફથી રોકાશે. અંધેરી સ્ટેશન સ્ટેશન પર કામચલાઉ ધોરણે ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૧ સુધી જ રોકાશે સંચોજન : એસી ચેર કાર અને એસી એક્ઝિક્યુટીવ ચેર કાર કોચીસ

ટ્રેન સંબંધિત વિગતવાર સમય અને સ્ટોપેજ માટે મુસાફરો ફૂપા કરીને

www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો

રની ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે આ ટ્રેનનું બુકિંગ ફક્ત આરસીટીસી વેબસાઇટ પર જ ખુલ્લું છે. ઉપરાંત, છેલ્લી મીનીટની મુસાફરીની આ ઉપરાંત, છેલ્લી મીનીટની મુસાફરીની ચોજના કરતા મુસાફરોની સુવિદ્યા માટે અમદાવાદ, સુરત અને મુંબઇ સેન્ટ્રલ રેલ્વે શનો પર આઇઆરસીટીસી હારા વધારાન

- કન્ફર્મ ટિકિટ હોય તે જ મુસાફરો આ ખાસ ટ્રેનોમાં પ્રવાસ કરી
- મુસાફરોને બોર્ડિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન અને મુકામ પર કોવિડ-૧૯થી સંબંધિત તમામ ધોરણો SOPs અને સુચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.



પશ્ચિમ રેલ્વે www.wr.indianrailways.gov.in અમને પસંદ કરોઃ 🖪 facebook.com/WesternRly સમાને ફોલો કરો: 🖸 twitter.com/WesternRly



બધી આરક્ષિત ટિકીટો માટે ઓળખપત્ર સાથે રાખો



CIN-L65190G11994PLC021012

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara 390 007, Gujarat, Phone: 0265-6722286 orate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Mumbai 400 051, Maharashtra, Phone: 022-26538900, Fax: 022-26531230 Website: www.icicibank.com, Email: investor@icicibank.com

NOTICE OF TWENTY-SEVENTH ANNUAL GENERAL MEETING

(AGM) of the Members of ICICI Bank Limited (the Bank/Company) will be held on Friday, August 20, 2021 at 3:00 p.m. IST through Video Conferencing/Other Audio Visual Means (VC/OAVM) to transact the Ordinary and Special Business, as set out in the Notice of the AGM in compliance with applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder read with General Circular Nos.14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs (MCA).

The Bank has on July 23, 2021 sent the Notice of the AGM and Annual Report 2020-21 through electronic mode only to those Members whose email addresses are registered with the Bank/Depository Participants in accordance with the above mentioned MCA Circulars and Circulars dated May 12, 2020 and January 15, 2021 issued by the Securities and Exchange Board of India. The Notice of the AGM and Annual Report 2020-21 can also be accessed on the Bank's website at https://www.icicibank.com/aboutus/annual.html, the website of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Members can participate in the AGM through VC/OAVM facility by following the instructions mentioned in the Notice of the AGM. The Bank is pleased to provide the Members the facility to exercise their right to vote at the AGM by electronic means. The Bank has appointed NSDL for facilitating voting through electronic means. Members including those who are holding shares in physical form or who have not registered their email addresses, can cast their votes by following the instructions mentioned in the Notice of the AGM.

Members are also informed that:

- 1. The remote e-voting period commences on Monday, August 16, 2021 (9:00 a.m. IST) and ends on Thursday, August 19, 2021 (5:00 p.m. IST). The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The remote e-voting shall not be allowed beyond the said date and time. Once the vote on a resolution is cast by the Member, the Member shall not be allowed to change it subsequently;
- 2. The facility for e-voting will be made available to the Members during the
- 3. Members who have cast their votes through remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes
- 4. Members who have not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.
- . A Person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cutoff date i.e. Friday, August 13, 2021 only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM.
- 6. Any person, who acquires shares of the Company and becomes Member of the Company after the date of sending of the Notice of the AGM and holds shares as on the cut-off date i.e. Friday, August 13, 2021, can cast the vote by following the instructions mentioned in the Notice of the AGM

In case of any queries or issues or grievances pertaining to e-voting, Members may refer to Help/FAQ's section available at www.evoting.nsdl.com or call on | Place: Mumbai toll free no.: 1800-1020-990/1800-224-430 or send a request at | Date : July 24, 2021

NOTICE is hereby given that the Twenty-Seventh Annual General Meeting | evoting@nsdl.co.in or contact Ms. Pallavi Mhatre, Manager, National Securities Depository Limited, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013, at pallavid@nsdl.co.in or at telephone no.: +91-22-24994545. Alternatively, Members may also write to the Company Secretary of the Bank at investor@icicibank.com or contact at telephone no.: +91-22-26538900.

> Members holding shares in dematerialised form are requested to register/update their email addresses with their Depository Participants. Members holding shares in physical form and who have not updated their email addresses with the Bank are requested to update their email addresses by writing to the Bank or 3i Infotech Limited, Registrar and Share Transfer Agent (R & T Agent), Tower # 5, 3rd Floor, International Infotech Park, Vashi Railway Station Complex, Vashi, Navi Mumbai 400 703 along with the copy of signed request letter mentioning the name, address and folio number, self-attested copy of the PAN Card, copy of the share certificate (front and back), and selfattested copy of any document (eg.: Aadhaar Card, Driving License, Election Identity Card, Passport).

> The Board of Directors at their Meeting held on April 24, 2021 have recommended payment of dividend of ₹ 2 per equity share of face value of ₹ 2 each for the financial year ended March 31, 2021. The Record Date for determining the names of members eligible for dividend on equity shares, if declared at the AGM, is July 30, 2021.

> Members holding shares in dematerialised form are requested to update their bank account details (including 9 digit MICR no. and 11 digit IFSC code no.) with their Depository Participants. Members holding shares in physical form are requested to update their bank account details (including 9 digit MICR no. and 11 digit IFSC code no.) by sending signed request letter mentioning their name, address and folio number to the Bank or Bank's R & T Agent along with selfattested copy of the PAN Card, copy of the share certificate (front and back) cancelled Cheque leaf and the self-attested copy of any document (e.g. Aadhaar Card, Driving License, Election Identity Card, Passport).

> As per the Income-tax Act, 1961 (the Act), as amended by the Finance Act, 2020, dividend paid or distributed by Bank after April 1, 2020 shall be taxable in the hands of the Members. The Bank shall therefore be required to deduct tax at source (TDS) at the prescribed rates at the time of making the payment of dividend to the Members. All communications/queries in this respect should be sent at icicibankdivtax@3i-infotech.com.

> In order to enable Bank to determine the appropriate tax rate at which tax has to be deducted at source under the respective provisions of the Act, Members are requested to provide the relevant documents/forms/declarations as may applicable to them at https://14.141.70.64/LIVE_TDS/TDSDocument Collection.aspx on or before August 2, 2021 (6.00 p.m. IST). The dividend will be paid after deduction of tax at source as determined on the basis of the documents provided by the Members as applicable to them and being found to be complete and satisfactory in accordance with the Act. For more details Members are requested to refer to the instructions mentioned in the Notice of the AGM. Members are also requested to update their tax residential status, PAN with the Bank or Bank's R &T Agent (where the shares are held in physical form) and with the Depository Participants (where the shares are held in demat form).

> > By Order of the Board Sd/-Ranganath Athreya **Company Secretary**



આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ સીઆઈએનઃ એલદ્દપ૧૯૦જીજે૧૯૯૪પીએલસી૦૨૧૦૧૨

રજીસ્ટર્ડ ઓફિસઃ આર્શસીઆઈસીઆઈ બેંક ટાવર, ચકલી સર્કલની પાસે, જુના પાદરા રોડ, વડોદરા ૩૯૦ ૦૦૭, ગુજરાત, **ફોનઃ** ૦૨૬૫-૬૭૨૨૮૬ કોર્પોરેટ ઓફિસ: આઇસીઆઇસીઆઇ બેંક ટાવર્સ, બાંદ્રા-ફુર્લા કોમ્પ્લેક્સ, મુંબઇ ૪૦૦ ૦૫૧, મહારાષ્ટ્ર, ફોનઃ ૦૨૨-૨૬૫૩૮૯૦૦, ફેક્સ: ૦૨૨-૨૬૫૩૧૨૩૦ จัดละเฮล: www.icicibank.com, ฮ์พิฮต: investor@icicibank.com

સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા અંગે નોટીસ

આથી અહીં નોટિસ આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેન્ક લિમિટેડ (બેન્ક/કંપની)ના સભ્યોની **સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા** (એજીએમ) **શુક્રવાર, ઓગસ્ત ૨૦, ૨૦૨૧ ના રોજ બપોરે** | લિમિટેડ, ટ્રેડ વર્લ્ડ, 'એ' વિગ, યોથો માળ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર 3.00 વાગે (ભારતીય સ્થાનિક સમય), કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની લાગુ પડતી જોગવાઈઓ અને તેના પરેલ, મુંબઈ ૪૦૦૦૧૩, pallavid@nsdl.co.in પર અથવા ટેલીફોન નંબર +૯૧-૨૨-૨૪૯૯૪૫૪૫ અંતર્ગત બનેલા નિયમો અનુસાર અને સાથે કોર્પોરેટ કાર્ય મંત્રાલય દ્વારા તા. એપ્રિલ ૮ , ૨૦૨૦, એપ્રિલ | ૧૩, ૨૦૨૦, મે પ, ૨૦૨૦ અને જાન્યુઆરી ૧૩, ૨૦૨૧ ના રોજ ક્રમશઃ જાહેર કરાયેલા જનરલ સર્ક્યુલર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦ અને ૦૨/૨૦૨૧ ને સાથે વાંયતા, વીડિયો કોન્કરન્સિંગ/અન્ય ઓડિયો વિઝ્યુલ માધ્યમ (વીસી/ઓએવીએમ) દ્વારા એજીએમની નોટિસમાં ઉલ્લેખ થયા પ્રમાણે સાધારણ અને ખાસ કાર્યોના વ્યવહારો અંગે યોજાશે.

ઉક્ત સર્ક્યુલર્સ અને સિક્યુરિટીઝ એન્ડ એક્સયેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા મે ૧૨, ૨૦૨૦ અને જાન્યુઆરી ૧૫, ૨૦૨૧ ના રોજ જાહેર કરાયેવા સર્ક્યુલર અનુસાર બેન્ક / ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ સાથે જેમના ઈમેઈલ એડ્રેસ નોંધાયેલા છે તેવા સભ્યોને બૅન્કે જુલાઈ ૨૩, ૨૦૨૧ના રોજ ઈલેક્ટ્રોનિક /aboutus/annual.html, તથા સ્ટોક એક્સચેન્જિસની વેબસાઈટ્સ જેમકે બીએસઈ વિમિટેડ www.bseindia.com અને નેશનવ સ્ટોક એક્સયેન્જ ઓફ ઈન્ડિયા વિમિટેડ www.nseindia.com તથા નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ)ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

એજીએમની નોટિસમાં જણાવેલ સૂચનોને અનુસરીને સભ્યો વીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં ભાગ વઈ શકે છે. બૅન્ક તેના તમામ સભ્યોને ઇલેક્ટોનિક માધ્યમ દ્વારા એજીએમમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટેની સુવિધા આપતા આનંદ અનુભવે છે. ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે બેન્કે એનએસડીએલની નિમણૂંક કરી છે. ફીસિકલ સ્વરુપમાં શર્સ ધરાવતા સભ્યો અથવા જેમને પોતાના ઇમેલ અડ્રેસ રજિસ્ટર કર્યા નથી તે સહિતનાં સભ્યો એજીએમની નોટિસમાં જણાવેલ સૂચનોનું પાલન કરીને પોતાનો મત આપી શકે છે.

સભ્યોને એ પણ જાણ કરવામાં આવે છે કે:

- ૧. રિમોટ ઈ-વોર્ટિંગનો સમય સોમવાર, ઓગસ્ટ ૧૬, ૨૦૨૧ના રોજ સવારે ૯.૦૦ વાગ્યાથી (ભારતીય સમય પ્રમાણે) શરુ થશે અને ગુરુવાર ઓગસ્ટ ૧૯, ૨૦૨૧ના રોજ સાંજે પ.૦૦ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે) સંપન્ન થશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા રિમોટ ઈ-વોર્ટિંગ મોડ્યુલ મત આપવા માટે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. રિમોટ ઈ-વોટિંગને ઉપરોક્ત તારીખ અને સમયથી આગળ મંજૂરી આપવામાં આવશે નહીં. એકવાર ઠરાવ અંગે મત આપી દીધા પછી સભ્યો તેમાં કોઈ પણ ફેરફાર કરી શકશે નહીં.
- ૨. ઈ-વોર્ટિંગ સુવિધા એજીએમ દરમ્યાન સભ્યો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
- 3. જે સભ્યો પોતાનો મત રિમોટ ઈ-વોર્ટિંગથી એજીએમઅગાઉ આપ્યો હોય, તેઓ એજીએમમાં સામેલ થઇ શકશે પણ ફરીથી મતદાન કરી શકશે નહીં.
- ૪. જે સભ્યો એ રિમોટ ઈ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મત ના આપ્યો હોય અને અન્યથા આમ કરવા માટે પ્રતિબંધિત ના હોય એવા સભ્યો એજીએમ દરમ્યાન ઈ-વોટિંગ પદ્ધતિ દ્વારા
- ૫. એ વ્યક્તિ કે જેનું નામ સંયાવિત રજીસ્ટર ઓફ મેમ્બર્સમાં અથવા ડિપોઝીટરીઝ દ્વારા સંચાલિત રજીસ્ટર ઓફ બેનિફિસયલ ઓનેર્સમાં કટ ઓફ ડેટ એટલેકે શુક્રવાર, ઓગસ્ટ ૧૩, ૨૦૨૧ના રોજ નોધાયેલું છે તે એજીએમ દરમ્યાન રિમોટ ઈ-વોર્ટિંગ અથવા ઈ-વોર્ટિંગની સુવિધા મેળવી શકશે.
- ૬.. કોઈ વ્યક્તિ કે જે કંપનીના શેર્સ એજીએમની નોટિસ રવાના થયા પછી ખરીદીને કંપનીનો સભ્ય બની જાય છે અને કટ ઓફ ડેટ એટલે કે શુક્રવાર, ઓગસ્ટ ૧૩, ૨૦૨૧ના રોજ શેરધારક છે તો તે | [5મેટ સ્વરુપમાં શેર્સ હોય) અપડેટ કરાવવી. સૂચનાઓ ને અનુસરીને મત આપી શકે છે.

આપ ઈ-વોટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ અથવા ફરિયાદોના કિસ્સામાં, કૃપા કરીને www.evoting.nsdl.com પરથી Help/FAQ's ના વિભાગનો સંદર્ભ વઈ શકો છે અથવા ટોવ ફ્રી i. ૧૮૦૦-૧૦૨૦-૯૯૦ / ૧૮૦૦-૨૨૪-૪૩૦ પર કોલ કરી શકો છો અથવા evoting@nsdl.co.in પર

અનુરોધ મોકલી શકો છે અથવા મિસ પલ્લવી મહાત્રે, મેનેજર, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, સભ્યો બૅન્કના કંપની સેક્રેટરીને investor@icicibank.com પર પણ લખી શકો છો અથવા ટેલિફોન નંબર +૯૧-૨૨-૨૬૫૩૮૯૦૦ પર સંપર્ક કરી શકો છો.

જે સભ્યો શેર્સ ડિ મટિરિયલાઈઝડ સ્વરુપે ધરાવે છે તેમને વિનંતી છે કે તેઓ તેમના ઈમેઈલ એડેસીસ સંબંધિત ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ પાસે નોંધણી/અપડેટ કરાવી લે. જે સભ્યો ફિઝિકલ સ્વરુપે શએર્સ ધરાવે છે અને જેમણે તેમના ઈમેઈલ એડ્રેસીસ બેન્ક સાથે અપડેટ કરાવ્યા નથી તેમને વિનંતી છે કે તેઓ તેમના ઈમેઈલ એડ્રેસીસ બેન્ક અથવા બેન્કના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ, ૩આઈ ઈન્ફોટેક લિમિટેડ (આર એન્ડ ટી એજન્ટ), ટાવર # ૫, ત્રીજો માળ, ઇન્ટરનેશનલ ઇન્ફોટેક પાર્ક, વાશી રેલ્વે સ્ટેશન કોમ્પ્લેક્ષ, વાશી, નવી મુંબઈ ૪૦૦ ૭૦૩ ને પોતાનું નામ, સરનામુ અને ફોલિયો નંબરનો પધ્દ્રતિ દ્વારા એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ મોક્લાવેલ છે. એજીએમની નોટિસ | ઉલ્લેખ કરી સ્વ હસ્તાક્ષર સહિતનો વિનંતી પત્ર લખીને સાથે પાન કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ નકલ, શેર અને વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ બેન્કની વેબસાઇટ https://www.icicibank.com સર્ટિફિકેટની નકલ (આગળ અને પાછળ) તથા કોઈ અન્યડોક્યુમેન્ટની સેલ્ફ એટેસ્ટેડ નકલ (દા.ત. આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈલેક્શન આઈડેન્ટીટી કાર્ડ, પાસપોર્ટ) આપીને નોંધણી / અપડેટ

> એપ્રિલ ૨૪, ૨૦૨૧ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી મિટિંગમાં તેમણે માર્ચ ૩૧, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પ્રત્યેક ₹ ૨ ના ફેસ વેલ્યુના ઇક્વિટિ શેર દીઠ ₹ ૨ ના ડિવિડન્ડ યુકવવાની ભલામણ કરી છે. જો એજીએમમાં જાહેર કરવામાં આવે તો ઇક્વિટિ શેરના ડિવિડન્ડ માટે પાત્રતા ધરાવતા સભ્યોના નામ નક્કી કરવા માટેની **રેકોર્ડ તારીખ જુલાઈ ૩૦, ૨૦૨૧** છે.

> જે સભ્યો શેર્સ ડિ મટિરિયલાઈઝ્ડ સ્વરુપે ધરાવે છે તેમને વિનંતી છે કે તેઓ તેમની બૅન્ક એકાઉન્ટ વિગત (૯ અંકના એમઆઈસીઆર નંબર અને ૧૧ અંકના આઈએફએસસી કોડ નંબર સહિત) સંબંધિત ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ પાસે અપડેટ કરાવી લે. જે સભ્યો ફિઝિકલ સ્વરુપે શએર્સ ધરાવે છે તેમને વિનંતી છે કે તેઓ તેમની બૅન્ક એકાઉન્ટ વિગત (૯ અંકના એમઆઈસીઆર નંબર અને ૧૧ અંકના આઈએફએસસી કોડ નંબર સહિત) બેન્ક અથવા બેન્કના આર એન્ડ ટી એજન્ટને પોતાનું નામ, સરનામુ અને ફોલિયો નંબરનો ઉલ્લેખ કરી સ્વ હસ્તાક્ષર સહિતનો વિનંતી પત્ર લખીને સાથે પાન કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ નકલ, શેર સર્ટિફિકેટની નકલ (આગળ અને પાછળ), કેન્સલ ચેકનું પાનું તથા કોઈ અન્ય ડોક્યુમેન્ટની સેલ્ફ એટેસ્ટેડ નકલ (દા.ત. આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈલેક્શન આઈડેન્ટીટી કાર્ડ, પાસપોર્ટ) આપીને અપડેટ કરાવી શકે છે.

> નાણાં અધિનિયમ, ૨૦૨૦ દ્વારા સુધારેલા આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ (એક્ટ) મુજબ, એપ્રિલ ૧, ૨૦૨૦ પછી બેંક દ્વારા ચૂકવણી અથવા વહેંચાયેલ ડિવિડન્ડ શેરધારકોના હાથમાં કરપાત્ર રહેશે. બેંન્ક ધ્વારા સભ્યોને ડિવિડન્ડની યુકવણીના સમયે નિર્ધારિત દરો પર કર કપાત (ટીડીએસ) ની આવશ્યકતા રહેશે. આ સંદર્ભમાંના તમામ સંદેશાવ્યવહાર/પ્રશ્નો icicibankdivtax@3i-infotech.com પર

> અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ સ્ત્રોત પર કર કપાત કરવો પડશે તે અંતર્ગત યોગ્ય કર દર નક્કી કરવા માટે બૅન્કને સક્ષમ બનાવવા માટે, સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે સંબંધિત દસ્તાવેજો / ફોર્મ્સ / ધોષણાઓ http://14.141.70.64/LIVE_TDS/TDSDocument Collection.aspx પર ઓગસ્ટ ૨, ૨૦૨૧ના રોજ સાંજે ૬.૦૦ વાગે (ભારતીય સ્થાનિક સમય) અથવા તે **પહેલા** દાખલ કરવા. વધુ વિગતો માટે, સભ્યોને એજીએમની નોટિસમાં જણાવેલ સૂચનાઓનો સંદર્ભ લેવા વિનંતી છે. સભ્યોએ તજવીજ કરેલા દસ્તાવેજો જે એક્ટ પ્રમાણે સંપૂર્ણ અને સંતોષકારક હશે તો તેના આધારે નક્કી કર્યા મુજબ સ્રોત પર કર કપાત પછી ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેમના કર રહેઠાણની સ્થિતિ, પાન, બૅન્ક અથવા બૅન્કના આર એન્ડ ટી એજન્ટને (જ્યાં શેર્સ ફિસિકલ સ્વરુપમાં હોય) અને ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ પાસે (જ્યાં

> > બોર્ડના આદેશથી, સહી/-રંગનાથ આથરેયા કંપની સેકેટરી

સ્થળઃ મુંબઈ તારીખઃ જુલાઈ ૨૪, ૨૦૨૧